

**XX-2039**

Seat No. \_\_\_\_\_

**M. Com. (Part - II) Examination**

April / May – 2003

**Advanced Statistics : Paper - IV**

*(Operations Research)*

*(New Course)*

Time : 3 Hours]

[Total Marks : 100

- સ્વીચ્છા :**
- (1) બધા પ્રશ્નોના ઉત્તર આપો
  - (2) દરેક પ્રશ્નના ગુણ સરખા છે.

- 1 (અ) સુરેખ આયોજન એટલે શું ? સુરેખ આયોજનના સામાન્ય પ્રશ્નનું ગાણિતિક મોડેલ દર્શાવો. 6
- (બ) એક ઔદ્યોગિક પેઢી એક ચીજવસ્તુનાં બે મોડેલ્સ – મોડેલ A અને મોડેલ Bનું ઉત્પાદન કરે છે. ઉત્પાદન પ્રક્રિયામાં ગ્રાણ તબક્કા છે – એસેમ્બલી, પેઈનિંગ અને પરીક્ષણ. તેને સુસંગત માહિતી નીચે મુજબ છે :

	વચ્ચા કિમત (એકમદીઠ)	દરેક એકમ માટે જરૂરી કલાકો		
		એસેમ્બલી	પેઈનિંગ	પરીક્ષણ
મોડેલ A	રૂ. 50	1.0	0.2	0.0
મોડેલ B	રૂ. 80	1.5	0.2	0.1
દરેક અઠવાડિયે પ્રાય્ કુલ કલાકો		600	100	30

આ માહિતીને આધારે, સુરેખ આયોજનના આ પ્રશ્નનું ગાણિતિક મોડેલ રચો.

**અથવા**

1 (અ) 
$$\begin{aligned} 2x_1 + 3x_2 &\leq 60 \\ 4x_1 + 3x_2 &\leq 96 \\ x_1, x_2 &\geq 0 \end{aligned}$$
 12

એ શરતોને આધીન  $Z = 40x_1 + 35x_2$  ને મહત્તમ બનાવો.

- (બ) દ્વારા પ્રશ્ન એટલે શું ? ઉપર (અ)માં આપેલા પ્રશ્નનો દ્વારા પ્રશ્ન મેળવો. ૮
- ૨ (અ) વાહનવ્યવહારનો પ્રશ્ન એટલે શું ? તેનું ગાણિતિક મોડેલ દર્શાવો. ૮
- (બ) નીચેના વાહનવ્યવહારના પ્રશ્નનો ઈછ ઉકેલ મેળવો : ૧૨

ક્રોકારો	ફેક્ટરી				આપ્સિ
	1	2	3	4	
1	10	8	11	7	20
2	9	12	14	6	40
3	8	9	12	10	35
જરૂરિયાત	16	18	31	30	95

અથવા

- ૨ (અ) કાર્ય વહેંચણીનો - ફાળવણીનો પ્રશ્ન એટલે શું ? તેનું ગાણિતિક મોડેલ દર્શાવો. ૮
- (બ) નીચેના કાર્યવહેંચણી - ફાળવણી (Work Assignment)) પ્રશ્નનો ઈછ ઉકેલ મેળવો : ૧૨

યંત્રો

	X	Y	Z	
P	17	25	31	
કાર્યો	Q	10	25	16
R	12	14	11	

- ૩ (અ) પૂર્ણાક સુરેખ આયોજન એટલે શું ? તેની ઉપયોગિતા સમજાવો. ૧૦
- (બ) કમિકતા (sequencing)ના પ્રશ્નને સંક્ષિપ્તમાં સમજાવો અને તેના ઉપયોગો લખો. ૧૦

અથવા

- ૩ (અ) જથ્થા નિયંત્રણ પદ્ધતિનું EOQ મોડેલ વિસ્તરથી વર્ણવો. ૧૦
- (બ) એક કંપની 'પેઈન બામ'ની 10,000 શીશીઓનું દર વર્ષે વેચાણ કરે છે. ૧૦  
એક બોટલ (શીશી)નો ઉત્પાદન ખર્ચ રૂ. 2 છે અને એક ઓર્ડર મૂકવાનો  
ખર્ચ રૂ. 100 છે. એક શીશીનો નિભાવ ખર્ચ 30 પૈસા છે. તો ઈછ વરદી  
(Order) જથ્થો મેળવો અને ન્યૂનતમ કુલ ખર્ચ મેળવો.
- ૪ (અ)  $M | M | 1: (\infty | FIFO)$  માટે હારની સરેરાશ લંબાઈ અને ગ્રાહકે  
સમગ્ર પદ્ધતિમાં ગાળવાનો સરેરાશ સમય એ બન્નેનાં સૂચો લખો. ૬
- (બ) એક બેન્કમાં પૈસા ઉપાડવા માટે બે કાઉન્ટરો ઉપર ગ્રાહકોનું આગમન ૧૪  
પોયસન ઢબે અને સેવા વિતરણ ઘાતાંકીય ઢબે થાય છે. બન્ને કાઉન્ટરો પર  
ગ્રાહકદીઠ સેવાનો સરેરાશ સમય 6 મિનિટનો છે. પહેલા કાઉન્ટર ઉપર  
દર કલાકે સરેરાશ પાંચ ગ્રાહકો અને બીજા કાઉન્ટર ઉપર દર કલાકે સરેરાશ  
આઠ ગ્રાહકો આવે છે. તો :
- (૧) દરેક કાઉન્ટર ઉપરનો પ્રતીક્ષા સમય શોધો.  
(૨) બન્ને કાઉન્ટર ઉપરનું કામ, દરેક કાઉન્ટર ઉપાડી શકતું હોય તો  
સરેરાશ પ્રતીક્ષા સમય કેટલો થશે ?

### **અથવા**

- ૪ (અ) 'પલાઝ્ય બિંદુ' (saddle point) અને મિશ્ર વ્યૂહરચના (mix strategies), ઉદાહરણ આપી સમજાવો. ૧૦
- (બ) નીચેની રમતનો ઈછ ઉકેલ મેળવો : ૧૦

### **રમતવીર $B$**

		<i>I</i>	<i>II</i>	<i>III</i>
		1	6	-1
<i>A</i>	2	3	4	0
	3	2	3	4

૫ (અ) PERT એટલે શું ? તેના ઉપયોગો જણાવો. તેના ગ્રાફ સમય આગાંકો વિષે લખો. ૮

(બ) નીચેના પ્રોજેક્ટ અંગેની માહિતીને આધારે જલાદતિ (network)ની રચના કરો. કટોકટીપથ શોધો. દરેક કાર્ય માટે કુલ Float શોધો : ૧૨

કાર્ય	સમય (માસમાં)	કાર્ય	સમય (માસમાં)
1-2	2	3-7	5
1-3	2	4-6	3
1-4	1	5-8	1
2-5	4	6-9	5
3-6	8	7-8	4
		8-9	3

### અનુભૂતિ

૬ ટૂંક નોંધ લખો : (ગમે તે ગ્રાફ)

- (૧) પુનઃસ્થાપનનો પ્રશ્ન
- (૨) પુનરાવર્તિત સિમ્પ્લેક્ષ પદ્ધતિ
- (૩) દ્વિઘાતી આયોજનની સમસ્યા
- (૪) કાર્યોત્તમક સંશોધનના ઉપયોગો
- (૫) ક્યૂ શિસ્ટ (Queue Discipline).

## ENGLISH VERSION

**Instructions :** (1) Attempt **all** questions.  
(2) They carry **equal** marks.

૧ (ા) What is Linear Programming Problem ? State the mathematical model of a generalised linear programming problem. ૮

- (b) An industrial firm engaged in producing two models      **12**  
of a product – model *A* and model *B*; performs only  
three operations – assembly, painting and testing.

The relevant data are as follows :

	<b>Unit sale Price</b>	<b>Hours required for each unit</b>		
		<b>Assembly</b>	<b>Painting</b>	<b>Testing</b>
<i>Model A</i>	Rs. 50	1.0	0.2	0.0
<i>Model B</i>	Rs. 80	1.5	0.2	0.1
Total number of hours available each week		600	100	30

Formulate a linear programming problem on the  
basis of this information.

**OR**

- 1**   (a) Maximize  $Z = 40x_1 + 35x_2$       **12**

Subject to

$$2x_1 + 3x_2 \leq 60$$

$$4x_1 + 3x_2 \leq 96$$

$$x_1, x_2 \geq 0$$

- (b) What is dual problem ? Obtain dual of the above      **8**  
problem given in 1(a).

- 2**   (a) What is transportation problem ? State its  
mathematical model.      **8**

- (b) Obtain an optimum solution to the following transportation problem : 12

<b><i>Warehouse</i></b>	<b><i>Factory</i></b>				<b><i>Availability</i></b>
	1	2	3	4	
1	10	8	11	7	20
2	9	12	14	6	40
3	8	9	12	10	35
<b><i>Requirement</i></b>	16	18	31	30	95

**OR**

- 2** (a) What is assignment problem ? State its mathematical model. 8
- (b) Obtain an optimum solution to the following assignment problem : 12

***Machines***

	<i>X</i>	<i>Y</i>	<i>Z</i>
<i>P</i>	17	25	31
<i>Jobs Q</i>	10	25	16
<i>R</i>	12	14	11

- 3** (a) What is integer linear programming problem ? Explain its usefulness. 10
- (b) Explain in brief the sequencing problem. Write its uses. 10

**OR**

- 3** (a) Describe at length the EOQ inventory model. 10
- (b) A company sells 10,000 bottles of 'Pain Balm'. The cost of production of one bottle is Rs. 2. The ordering cost is Rs. 100. The inventory holding cost of one bottle is 30 paise. Obtain Economic Order Quantity and minimum total cost. 10

- 4** (a) Write the formulas for 'The average queue length' **6** and 'Average customer waiting time in the system', for  $M + M + 1: (\infty | \text{FIFO})$ .
- (b) In a bank, there are 2 counters for withdrawals. **14** Customers arrive in a Poisson fashion and the services follow exponential pattern. The average service time for both the counters is 6 minutes per customer. At the first counter, 5 customers arrive every hour on an average and at the second counter 8 customers arrive every hour on an average :
- (1) Find average waiting time for each counter
  - (2) If one counter handles the work for both the counters, what is average waiting time ?

### OR

- 4** (a) Explain 'Saddle Point' and 'Mix Strategies' giving **10** illustrations.
- (b) Obtain optimum solution of following game : **10**

		<b><i>Player B</i></b>		
		<i>I</i>	<i>II</i>	<i>III</i>
<b><i>Player A</i></b>	1	6	-1	5
	2	3	4	0
	3	2	3	4

- 5** (a) What is PERT ? Write its uses. Write about its three **8** time estimates.

- (b) Construct the network on the basis of following **12** information about a project. Find critical path. Find total float for each activity :

<b>Activity</b>	<b>Time (Months)</b>	<b>Activity</b>	<b>Time (Months)</b>
1–2	2	3–7	5
1–3	2	4–6	3
1–4	1	5–8	1
2–5	4	6–9	5
3–6	8	7–8	4
		8–9	3

## **OR**

- 5** Write short notes : (any **three**) **20**

- (1) Replacement Problem
  - (2) Revised Simplex Method
  - (3) Quadratic Programming Problem
  - (4) Uses of Operation Research
  - (5) Queue Discipline
-